

## સાતમા પગારપંચની ભલામણ મુજબ પગાર બાંધણી નિયત કરવા માટેની તબક્કાવાર કાર્યવાહિ

- (૧) IFMS માં ઉપાડ અધિકારી / પગાર બાંધણીના Rights ધરાવતા અધિકારીશ્રીએ લોગીન કરવું.
- (૨) આ રીતે લોગ ઈન કર્યા બાદ નીચે મુજબની લીંકમાં કર્મચારીઓના કેસ જોઈ શકાશે.
  - **Work list > Pay fixation > Approved cases.** (૦૧-૦૧-૨૦૦૬ પછી નોકરીમાં દાખલ થયેલ કર્મચારીઓ માટે)
  - **Work list > Pay fixation > Received cases.** (૦૧-૦૧-૨૦૦૬ પહેલાં નોકરીમાં દાખલ થયેલ કર્મચારીઓ માટે)
- (૩) ઉક્ત લીંકમાં સંબંધિત કચેરીના કર્મચારીઓના નામની યાદી દર્શાવતી સ્ક્રીન દેખાશે. આ નામ પૈકી જે કર્મચારીની પગાર બાંધણી કરવાની હોય તેની સામેના બોક્ષમાં ટીકમાર્ક કરી પસંદ કરવાનું રહેશે. Search ની ફંક્શનાલીટીથી પણ જે કર્મચારીનું પગાર નિયત કરવાનું થાય તેઓનો કેસ શોધી શકાશે.
- (૪) સ્ક્રીનની નીચે “Office Order”ની લીંક પર ક્લિક કરવાથી છઠ્ઠા પગારપંચ મુજબની નિયત કરેલ પગારની વિગતો ખુલશે, જેમાં સંબંધિત કર્મચારીની તમામ ઈવેન્ટ સહિતની વિગતો ચકાસી લઈ, કેસમાં જરૂરી સુધારા થયાની ખાતરી કરી લેવી.
- (૫) “7<sup>th</sup> pay office order” ની લીંક તેમજ Annexure ની લીંક પર ક્લિક કરી Order અને Annexure જનરેટ કરવા તથા પગારબાંધણીની વિગતો સરકારશ્રીના સાતમા પગારપંચ અન્વયેની પગારબાંધણીના નીતિ નિયમો પ્રમાણે છે તેની ચકાસણી કરી લેવી.
- (૬) જો કોઈ કર્મચારીની પગારને લગતી વિગતો અપડેટ (Update) કરવાની બાકી હોય (જેમકે, બઢતી / ઉચ્ચતર પગારધોરણની વિગતો, ઈજ્જા છોડવા, નોકરીમાં જોડાયા તારીખ, હોદ્દા ફેરફાર, વગેરે) તો GPF નંબરની હાઈલાઈટેડ લીંક પર ક્લિક કરતાં તે કર્મચારીની વિગતો ધરાવતી સ્ક્રીન ખુલશે અને કેસ અપડેટ કરી શકાશે.
- (૭) જો Pay Fixation બાબતે કોઈ વિસંગતતા જણાય અથવા કોઈ ટેકનિકલ મુશ્કેલી ઉપસ્થિત થાય તો નીચે દર્શાવેલ અધિકારીશ્રી / પ્રતિનિધિનો સંપર્ક સાધવો તથા સ્ક્રીનશોટ વગેરે તમામ વિગતો સાથે નીચે જણાવ્યા મુજબના ઈ-મેલ આઈ ડી પર ઈ-મેલ મોકલવો.
  - શ્રી બી જે દવે, હિસાબી અધિકારી, ઈડીપી સેલ, હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, ગાંધીનગર.  
(૦૭૯) ૨૩૨ ૫૬૩૪૧  
edpmgr5-dat@gujarat.gov.in
  - શ્રી એમ એમ પટેલ, હિસાબી અધિકારી, પગાર ચકાસણી એકમ, હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, ગાંધીનગર.  
૦૭૯ ૨૩૨ ૫૬૫૪૯
  - TCS Helpdesk, ઈડીપી સેલ, હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, ગાંધીનગર.  
૦૭૯ ૨૩૨ ૫૭૩૨૬ / ૦૭૯ ૨૩૨ ૫૭૩૨૫  
[supt-sys-dat@gujarat.gov.in](mailto:supt-sys-dat@gujarat.gov.in)